

ફોર્મ

અજમાયથી ધોરણે નિયુક્ત કરાયેલાં અધિકારીઓ અંગે પ્રથમ-દિવિય વાર્ષિક મુલ્યાંકન અહેવાલ
તારીખ..... થી તા..... ના સમયનો અહેવાલ.

ભાગ-૧ હડિકાતલથી માહિતી.

(અધિકારીએ જાતે ભરનું)

૧	નામ	:-
૨	જન્મ સ્થળ	:-
૩	વતન (ગ્રામ) શહેર	:-
૪	જન્મ તારીખ	:-
૫	નિમણું કરી તારીખ	:-
૬	વિભાગ/ કચેરી	:-
૭	ધારણ કરેલ જગ્યા	:-
૮	અહેવાલના સમય દરમાન મેળવેલ તાલીમ/ પરીક્ષા વિગેરની વિગતો.	:-
૯	અજમાયથી સમય પૂર્વી કરવાની તારીખ	:-
૧૦	અજમાયથી સમય દરમાન ખોગવેલ રજાઓ/ પરચૂરણ રજાઓ સ્ક્રિવાય અથવા ગેરધાજરીનો સમય જો છોય તો.	:-

ભાગ-૨

(સ)	કર્ણો અને જવાબદારીઓનું સંક્ષિપ્ત વૃત્તાત (૫૦ શબ્દો કરતાં વધુ નથી.	:-
(અ)	અજમાયથી સમય દરમાન ખરેખર બજાવેલ કામગીરી	:-

ભાગ-૩

ક્રમાંક	કામગીરીની વિગત	મુલ્યાંકન
૧	સારી સૈક યોગ્યતા અંગે અભિપ્રાય	:-
૨	કામમાં રસ અધ્યાત્મા ખાસ રૂષી	:-
૩	કુમકુરવાની તત્ત્વપરતા	:-
૪	પહેલ આવૃત્તિ	:-
૫	સ્વનિર્ભર	:-
૬	જવાબદારી ધારણ કરવાની ઈચ્છુકતા	:-
૭	પ્રમાણિકતા	:-
૮	શરીત (અ) નિર્ધાર લેવાની (બ) ગહણ કરવાની અને વ્યક્ત કરવાની	:-
૯	કામગીરીની ગુણવત્તા	:-
૧૦	મૌખિકમાં અને લેખિતમાં બંનેમાં વ્યક્ત કરવાની અસરકારકતા	:-
૧૧	અજ્ઞાતિક પણો અને કરજ પ્રત્યેની નિષ્ઠા	:-

ક્રમાંક	કાન્ગરીરોની વિગત	મૂલ્યાંકન
૧૨	સામાન્ય માણસ પ્રત્યેનો અભિગમ વર્તાવ	:-
૧૩	સરકારી નોકરીમાં યોગ્યતા અંગે અભિપ્રાય	:-
૧૪	નિયમિત હવાલો સૌંપત્તા પહેલાં તાલીમ આપવાની જરૂર છે ખરી.	
૧૫	સંબંધિત વિષયોને લગતાં નિયમો, અધિનિયમો, વિનિયમોનું શાન	:-
૧૬	ગુજરાતી ભાષાનું શાન	:-
૧૭	અહેવાલ સમય દરમ્યાન ધ્યાન ઉપર જો કોઈ ખામીઓ/ઉલ્લાપો થવાને પામી હોય તો તેની વિગત.	:-
૧૮	અહેવાલના સમય દરમ્યાન જો અધિકારીને કોઈ રિક્ષા ધરી હોય તો તે વિગતે દર્શાવવી. જો કોઈ ખાતાકીય તપાસ પડતર હોય તો તેની ખાહિતી અને પ્રગતિ પરં દર્શાવો.	:-
૧૯.	સમગ્ર કાન્ગરીરીનું મૂલ્યાંકન	:-

સ્થળ:—

તારીખ :—

અધિકારીની સહી/-
(કુચેરી / ખાતાના વડા)

સમીક્ષા અધિકારી ધ્યારા મૂલ્યાંકન:—.....

(સમીક્ષા કરનાર અધિકારીની સહી અને હોદ્દો)